

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટનો પ્રારંભ જુન 11ના રોજથી થશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 મે 2022) – સીટી ઓફ બ્રેમ્પટનની વાર્ષિક ફાર્મર્સ માર્કેટ 2022ની સિઝન માટે ફરી જુન 11ના રોજથી ભરાશે જેને રજૂ કરે છે મેરિડિયન ક્રેડિટ યુનિયન. આ સાપ્તાહિક ઇવેન્ટ ઓક્ટોબર 8 સુધી તડકો હોય કે વરસાદ દર શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હાથ ધરાશે. આ વર્ષે આપણો માનીતો પ્રસંગ જ્યોર્જ સ્ટ્રીટ અને મેઈન સ્ટ્રીટ સાઉથની વચ્ચે વેલિંગ્ટન સ્ટ્રીટ પર અને ગેજ પાર્કમાં થશે.

આ સિઝનમાં આ ઇવેન્ટમાં ચોક્કસ જ બધા લોકોને જરૂરથી ગમી જાય એવી બાબતો સામેલ છે:

- માર્કેટના મનપસંદ ખેડુતો, વેચાણકર્તાઓ અને સ્થાનિક કલાકારો જેઓ તાજો પાક અને હાથ બનાવટની વસ્તુઓ વેચશે.
- બ્રેમ્પટન ફોક ક્લબ, B-Jazzed, ડીજે જોનાથન શૉ અને બીજા ઘણા બધા બેન્ડસ્ટેન્ડ પરથી લાઈવ મનોરંજન પૂરું પાડશે;
- ઓન-સાઈટ આર્ટ એક્ટિવેશનો કરશે સિટી ઓફ બ્રેમ્પટન આર્ટ્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ડિવલપમેન્ટ એજન્સી (ACCIDA); અને
- બીજું ઘણું બધું!

### ડાઉનટાઉન બ્રેમ્પટન પરિવર્તનના પંથે

ડાઉનટાઉન બ્રેમ્પટન ખાતે પરિવર્તન થઈ રહ્યું છે રિજન ઓફ પીલ એક પરિયોજના ચલાવી રહ્યા છે જેમાં વોટરમેઈન અને વિસ્તારની ગટરની લાઈનો બદલવામાં આવી રહી છે. તેના પરિણામે ઘણા બધા માર્ગો બંધ છે. માર્કેટ તરફ દોટ મુકતા પહેલા મહેરબાની કરીને બરાબર પ્લાન કરશો.

નગરપાલિકાના પાર્કિંગ અપડેટ અહીં મળશે [brampton.ca](http://brampton.ca) અથવા ત્યાં પહોંચવા માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરશો. આની મદદ લઈને પહેલેથી તમારી સફરનું આયોજન કરશો [ટ્રિપલિન્ક્સ \(Triplinx\)](http://triplinx.com).

2022 બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટના ઉદ્દેશ પ્રાયોજકો છે અલગોમા યુનિવર્સિટી, બોર્ડવોક, ફ્લેટો ડિવલપમેન્ટ્સ, સ્વેરા અને ટોરોન્ટો પિઅરસન.

આ સિઝનના વેન્ડરો અને પ્રોગ્રામિંગ અંગે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો [brampton.ca/markets](http://brampton.ca/markets).

સુવાક્યો

"બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટનું વાર્ષિક ધોરણે પાછું ફરવું એટલે બિનસત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થઈ એમ કહી શકાય! બ્રેમ્પટનમાં આ મનપસંદ પ્રસંગ આખા સમાજને ભેગો લાવે છે અને હું આ પરંપરાને દર વર્ષે જોવા ઉત્સુકતાથી રાહ જોઉં છું. જુન 11 ની તારીખ તમારા કેલેન્ડરોમાં લખી રાખશો. તો મળીએ ત્યાં જ!"

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટને ફરી જોતા મને આનંદ થાય છે અને હું સમાજ અને સ્થાનિક વ્યવસાયોને આનંદ લેતા જોવા ઉત્સુક છું. અમારા ઉદાર પ્રાયોજકોનો ખૂબ આભાર કે તેમણે આ સિઝનના મનપસંદ પ્રસંગને ચાલુ રાખ્યો!"

- હરકિરત સિંઘ ઉપ-પ્રમુખ, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"ડાઉનટાઉન બ્રેમ્પટન જ્યારે રોમાંચક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તે અગત્યનું છે કે આપણે આપણા સ્થાનિક વ્યવસાયોને અને વિક્રેતાઓને આપણું સમર્થન આપીએ. સિટી ઓફ બ્રેમ્પટને આ સિઝનનું એક સરસ આયોજન કરી લીધું છે જેમાં વિવિધ વસ્તુઓ અને મનોરંજનને સમાવી લીધું છે જેથી સમસ્ત બ્રેમ્પટનનો સમાજ તેને માણી શકે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)